



# ભારત મૌસમ વિભાગ અને તેની વિવિધ ઓપ્લીકેશનોની માહિતીઓ



ડૉ. નીરજ કુમાર, ડૉ. એચ. બી. સોડવડીયા, ડૉ. એચ. એચ. પટેલ  
શ્રી. ડી. પી. કમાણી, ડૉ. ડી. ડી. પટેલ

સાસ્ય વિજ્ઞાન વિભાગ, કોલેજ ઓફ એન્જીનિયરિંગ, કેમ્પસ ભરૂય  
નવસારી કુષ્ણ યુનિવર્સિટી  
ભરૂય - ઉદ્રોહ ૨૦૨૦૧૨

યુનિવર્સિટી પ્રકાશન નં. : ૮૨/૨૦૨૧-૨૨

ભારત મૌસમ હવામાન વિભાગની સ્થાપના ૧૮૭૫ માં કરવામાં આવી હતી. તે દેશની રાષ્ટ્રીય હવામાન સેવા અને હવામાનશાખા સંબંધિત તમામ વિષયોને લગતી બાબતોમાં મુજબ સરકારી એજન્સી છે.

- હવામાનશાખા અને તેને સંલગ્ન શાખાઓમાં સંશોધન કરવું અને પ્રોત્સાહન આપવું.
- ભારત મૌસમ વિભાગ ઉષ્ણકટિબંધીય ચકવાત, નોર્વેસ્ટર, ધૂળના તોફાન, ભારે વરસાદ અને કરા પાડવા, ઠંડી અને ગરમીના મોજા વગેરે જેવી ગંભીર હવામાન ઘટનાઓ સામે ચેતવણી આપે છે, જે જીવન અને સંપત્તિના વિનાશનું કારણ બને છે.
- ભારત મૌસમ વિભાગ કૃષિ, જળ સંસાધન વ્યવસ્થાપન, ઉદ્યોગો, તેલ સંશોધન અને અન્ય રાષ્ટ્ર નિર્માણ પ્રવૃત્તિઓ માટેના જરૂરી આંકડા પૂરા પાડે છે.
- ભારત મૌસમ વિભાગ હવામાનના અવલોકનો લેવા અને તે કૃષિ, સિંચાઈ, શિથિંગ, ઉફ્યન, દરિયાડ્રિનારે તેલ સંશોધન વગેરે જેવી હવામાન સંવેદનશીલ પ્રવૃત્તિઓના મહત્તમ સંચાલન માટે વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી હવામાન આધ્યારિત આગાહી પૂરી પાડે છે.

### ભારતમાં હવામાન સેવાઓનો ઇતિહાસ :

ભારતમાં હવામાનશાખની શરૂઆત પ્રાચીન કાળથી થઈ છે. ૩૦૦૦ BC ના પ્રારંભિક દાર્શનિક યુગમા, જેમ કે ઉપનિષદમાં, વાદળની રચના, વરસાદની પ્રક્રિયાઓ અને પૃથ્વીની સૂર્યની આસપાસની હિલચાલને કારણે થતા મોસમીયક વિશે ગંભીર ચર્ચા છે. વરાહમિહિરાની શાખીય કૃતિ, બૃહત્સંહિતા, જે ૫૦૦ ઈ.સ.ની આસપાસ લખાયેલી છે, તે સ્પષ્ટ પુરાવો આપે છે કે તે સમયે પણ વાતાવરણીય પ્રક્રિયાઓનું ઊંઠું નોલેજ અસ્તિત્વમાં હતું. તે સમજી શકાયું હતું કે વરસાદ સૂર્ય (આદિત્ય જ્યતે વૃષ્ટિ) માંથી આવે છે અને વરસાદની મૌસમમાં (સિજનમાં) સારો વરસાદ એ સારી જેતી અને લોકો માટે બોરાકની ચાવી છે. ક્રૌણિકાના અર્થશાખમાં વરસાદના વૈજ્ઞાનિક રીતે માપવાનો રેકોર્ડ છે તેનો ઉપયોગ દેશની આવક અને રાહત કાર્યમાં થાય છે. કાલિદાસે સાતમી સદીની આસપાસ લખેલા તેમના મહાકાવ્ય ‘મેઘદૂત’ માં મધ્ય ભારતમાં ચોમાસાના શરૂઆતની તારીખનો પણ ઉલ્લેખ કર્યો છે અને ચોમાસાના વાદળોનો માર્ગ શોધી કાઢ્યો છે.

હવામાનશાખા, જેમ આપણે તેને સમજીએ છીએ, ૧૭ મી સદીમાં થમોભીટર અને બેરોમીટરની શોધ અને વાતાવરણીય વાયુઓના વર્તનને નિયંત્રિત કરનારા કાયદાઓની રચના પછી તેનો મજબૂત વૈજ્ઞાનિક પાયો હોવાનું કહેવાય છે. ૧૯૭૬ માં બ્રિટિશ વૈજ્ઞાનિક હેલીએ ભારતીય ઉનાણાના ચોમાસા પર પોતાનો ગ્રંથ પ્રકાશિત કર્યો હતો, જેને તેમણે એશિયન ભૂમિસમૂહ અને હિંદ મહાસાગરના વિભેદક ગરમીને કારણે પવનના મોસમી પલટાને આભારી છે.

ભારત નસીબદ્ધ છે કે તે વિશ્વની સૌથી જૂની હવામાનશાખીય વેધશાળાઓ ધરાવે છે. બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના હવામાન અને આબોહવાનો અભ્યાસ કરવા માટે ૧૭૮૫ માં કલક્તા અને ૧૭૮૯ માં મદ્રાસ (હવે ચેન્નઈ) માં આવા અનેક સ્ટેશનોની સ્થાપના કરી હતી. એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના ૧૭૮૪ માં કલક્તા ખાતે અને ૧૮૦૪ માં બોમ્બે (હાલ મુંબઈ) માં થઈ, તેણે ભારતમાં હવામાનશાખમાં વૈજ્ઞાનિક અભ્યાસોને પ્રોત્સાહન આપ્યું. કલક્તા ખાતે કેટન હેરી પિટિંગને ૧૮૩૫ - ૧૮૫૫ દરમિયાન જર્નલ ઓફ ધ એશિયાટિક સોસાયટીમાં ઉષ્ણકટિબંધીય તોફાનોનો સામનો કરતા ૪૦ પેપરો પ્રકાશિત કર્યા અને “સાયક્લોન” શબ્દનો અર્થ કર્યો, જેનો અર્થ સાપની કોઇલ છે. ૧૮૪૨ માં તેમણે “તોફાનોના નિયમો” પર તેમનું સ્મારક કાર્ય પ્રકાશિત કર્યું. ૧૮ મી સટીના પહેલા ભાગમાં, પ્રાંત સરકારો હેઠળ ભારતમાં ઘણી વેધશાળાઓ કાર્યરત થવા લાગી.

એક વિનાશક ઉષ્ણકટિબંધીય ચકવાત ૧૮૬૪ માં કલક્તા પર ગ્રાટક્યું હતું અને આ પછી ૧૮૬૬ અને ૧૮૭૧ માં ચોમાસાના વરસાદની નિષ્ફળતા આવી હતી. વર્ષ ૧૮૭૫ માં, ભારત સરકારે ભારતના હવામાન વિભાગની સ્થાપના કરી હતી, જે દેશના તમામ હવામાન કાર્યને કેન્દ્રિય સત્તા હેઠળ લાવે છે. શ્રી એચ એફ બ્લાન્ફોર્ડને ભારત સરકારના નેજા હેઠળ હવામાન વિભાગના રિપોર્ટર બનાવ્યા હતા. ઓઝર્વર્ટરીઝના (વેધશાળાના) પ્રથમ ડાયરેક્ટર તરીકે જનરલ સર જહોન એલિયટ હતા જેમને કલક્તા હેડકવાર્ટરમાં મે ૧૮૮૮ માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત મૌસમ વિભાગનું મુખ્ય મથુર પહેલા શિમલા, પદ્ધી પૂના (હવે પુણે) અને છેલ્લે નવી દિલ્હી ખસેડવામાં આવ્યું.

૧૮૭૫ માં સાધારણ શરૂઆતથી, ભારત મૌસમ વિભાગે ધીમે ધીમે હવામાનશાખીય અવલોકનો, સંદેશાવ્યવહાર, આગાહી અને હવામાન સેવાઓ માટે તેના ઈન્ફાસ્ટ્રક્ચરને વિસ્તૃત કર્યું છે અને તેણે સમાંતર વૈજ્ઞાનિક વૃદ્ધિ હાંસલ કરી છે. ભારત મૌસમ વિભાગે હંમેશા સમકાલીન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ટેલિગ્રાફ યુગમાં, તેણે નિરીક્ષણ ટેટા એકત્રિત કરવા અને ચેતવણીઓ મોકલવા માટે હવામાન ટેલિગ્રામનો બાપુક ઉપયોગ કર્યો. બાદમાં ભારત મૌસમ વિભાગે ભારતમાં વૈધિક ટેટા ટ્રાન્સફરને ટેકો આપવા માટે મેસેજ સ્લિવિંગ કોમ્પ્યુટર ધરાવતી પ્રથમ સંસ્થા બની. દેશમાં ૨૭૪ કરાયેલા પ્રથમ કેટલાક ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સમાંથી એક ભારત મૌસમ વિભાગને હવામાનશાખમાં વૈજ્ઞાનિક ફ્લેચ ચાલતી એપ્લિકેશન માટે પ્રદાન કરવામાં આવ્યું હતું. ભારત વિશ્વનો પહેલો વિકાસશીલ દેશ હતો જેની પાસે પોતાનો જિયોસ્ટેશનરી ઉપગ્રહ અને ઈન્સેટ હતો તેના દ્વારા સતત હવામાનની દેખરેખ અને ખાસ કરીને ચકવાતની ચેતવણી માટે ઉપયોગ થતો હતો.

ભારત મૌસમ વિભાગ એપ્લિકેશન (સપ્લાય) અને સેવાના નવા ક્રોમાં સતત સાહસ કર્યું છે, અને તેના ૧૪૦ વર્ષના ઇતિહાસમાં તેના ઈન્ફા-સ્ટ્રક્ચર પર પણ સતત નિર્માણ કર્યું છે. તેણે વારાફરતી ભારતમાં હવામાનશાસ્ત્ર અને વાતાવરણીય વિજ્ઞાનના વિકાસને પોષ્યું છે. આજે, ભારતમાં હવામાનશાસ્ત્ર ભવિષ્યની એક ઉતેજક ઉંચાઈ પર છે.

### મેધદૂત એપ્લીકેશન:

બદલતા વાતાવરણની પરિસ્થિતિમાં સફળ ખેતી એક પડકારરૂપ છે. વિપરીત હવામાન પરિસ્થિતિમાં ઓછા નુકશાને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે હવામાનની આગાહીની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા ખેડુતોને હવામાનની આગાહી અને હવામાન આધ્યારિત સલાહકારી સેવાનો લાભ મળી શકે તે માટે ભરુય જલ્દ્યામાં "Gramin Krishi Mausam Seva (GKMS)" પ્રોજેક્ટ કાર્યરત છે. ભરુય જલ્દ્યામાં "GKMS" પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય, ભરુય ખાતેના કૃષિ હવામાન શાસ્ત્ર વિભાગ અંતર્ગત કામ કરતાં ટેકનિકલ ઓફિસર અને જુદા જુદા વિષયના નિષ્ણાંત દ્વારા હવામાનની આગાહી તેમજ કૃષિ હવામાન સલાહકારી સેવા આપવામાં આવે છે.

ખેડુતોને મોબાઇલ પર એસ.એમ.એસ. દ્વારા તથા મેધદૂત એપ્લીકેશન દ્વારા હવામાનની આગાહીની જાણકારી તથા કૃષિ કામગીરી અને તેમના પાક તથા પશુધનની સાર સંભાળ કેવી રીતે લેવી તેની સલાહ આપવામાં આવે છે. જેથી ખેડુતો આ માહિતીનો ઉપયોગ કરી બદલાતા વાતાવરણની પરિસ્થિતિમાં વધુ ઉત્પાદન મેળવી શકે.

### મેધદૂત એપ્લીકેશન

પૃથ્વી વિજ્ઞાન અને કૃષિ મંત્રાલય દ્વારા 'મેધદૂત' નામે એક મોબાઇલ એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે. જે ખેડુતોને સ્થાનિક ભાવામાં ખેતીપાકો અને પશુધન વિશે હવામાન આધ્યારિત કૃષિ સલાહ પ્રદાન કરે છે.

મેધદૂત એપ્લીકેશન ભારતીય હવામાન વિભાગ, ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર અને ભારતીય કૃષિ સંશોધન પરિષદની સંયુક્ત પહેલ છે, જેનો હેતુ મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા ખેડુતોને મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવાનું છે.

### મેધદૂત એપ્લીકેશનના લાભો

- ખેડુતોને તાપમાન, વરસાદ, ભેજ, પવનની ગતિ અને દિશાને લગતી આગાહી અને માહિતી આપે છે.
- ખેડુતોને કૃષિ કામગીરી અને તેમના પાક તથા પશુધનની સારસંભાળ કેવી રીતે લેવી તે

અંગેની સલાહ માટે આ એપ્લીકેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવામાનની આગાહી અંગેની માહિતી એમ અઠવાડિયામાં બે વાર (મંગળવાર અને શુક્રવાર) મુકવામાં આવે છે. મોબાઈલ એપ્લીકેશનમાં છબીઓ, નકશા અને ચિત્રોનાં રૂપમાં માહિતી પ્રદાન કરે છે. જેથી ખેડૂતોને સમજવામાં સરળતા રહે. ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ પહોંચાડવા માટે WhatsApp ના માધ્યમથી ભરુચ જિલ્લાના વિવિધ તાલુકાના શુપ સાથે ઝોડવામાં આવ્યા છે અને કૃષિ સલાહ બુલેટિન મોકલવામાં આવે છે.

મેઘદૂત એપ્લીકેશન Google Play Store અને AppStore પર ઉપલબ્ધ છે વપરાશકર્તાઓએ તેમના નામ અને સ્થાનની નોંધણી કરાવવાથી તેઓને તેમના વિસ્તાર વિશેની હવામાન આધારિત કૃષિ સલાહની માહિતી મળી રહે છે અને તેને Google Play Storeમાં કેવી રીતે ડાઉનલોડ કરાય તેની માહિતી નીચે આપેલ છે.

1. તમારા મોબાઈલના Google Play Storeમાં જઈ Meghdoot નામની એપ્લીકેશન શોધી ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરો.
2. એપ્લીકેશન ઈન્સ્ટોલ કર્યા બાદ રજીસ્ટ્રેશન માટે તમારો ફોન નંબર અને ભાષામાં ગુજરાતી ભાષાનો વિકલ્પ પસંદ કરી સાઈન અપ કરવું.
3. સાઈન અપ કર્યા બાદ મળેલ માહિતી જેવી કે, તમારું નામ, ફોન નંબર, જાતિ, રાજ્ય અને જિલ્લાનું નામ નાખી, નોંધણી કરેનો વિકલ્પ પસંદ કરવો.
4. નોંધણી કર્યા બાદ આપેલ ફોટોમાં દર્શાવ્યા મુજબ માહિતી મળશે, જેમાં તમને હવામાનના પરિબળો જેવા કે લધુતમ તથા મહત્વમાન, વરસાદ, ભેજની ટકાવારી, પવનની ઝડપ તેમજ પવનની દિશા ની માહિતી મળશે. ત્યાર બાદ તમે જે જિલ્લાની પસંદગી કરી હશે તે જિલ્લાના મુખ્ય પાકની હવામાન આધારિત કૃષિ હવામાન સલાહ મળશે.
  - "છેલ્લા હવામાન" વિકલ્પ પસંદ કરતાં છેલ્લા પખવાડિયાના હવામાન અંગેની માહિતી મળશે
  - "આગાહી" વિકલ્પ પસંદ કરતાં આવનારા પાંચ દિવસનાં હવામાન અંગેની જાણકારી મળશે
  - "ઉડતી નજર" વિકલ્પ પસંદ કરતાં બીજા રાજ્ય તેમજ બીજા જિલ્લાની કૃષિ હવામાન અંગેની માહિતી મળશે.
  - "સ્થાનોનું સંચાલન કરો" વિકલ્પ પસંદ કરતાં રાજ્ય અને જિલ્લો બદલી શકાશે.



## Meghdoot

IMD - AAS Weather

Everyone

This app is available for your device:

★★★★★ 903

Installed



**REGISTRATION**

First Name \*

Last Name

Mobile \*

Preferred Language \*

English

Gender

Select

State \*

Select

District \*

Select

Terms and Conditions

[Cancel](#) [Register](#)

આજાની અને આજીની દિવાની પ્રકાશન રૂપરેખા	
જુન 26 બિને	જુન 29 સ્વિ.
30 ° મહત્તમ	64 %
આરીક વારણાય	55% વિનાયક / કાલીયાદી
જાણો એની વારણાય	જાણો એની વારણાય
જાણો એની વારણાય	જાણો એની વારણાય
જાણો એની વારણાય	જાણો એની વારણાય
જાણો એની વારણાય	જાણો એની વારણાય
જાણો એની વારણાય	જાણો એની વારણાય
જાણો એની વારણાય	જાણો એની વારણાય
જાણો એની વારણાય	જાણો એની વારણાય
જાણો એની વારણાય	જાણો એની વારણાય

## મૌસમ એપ્લિકેશન

મૌસમ એ ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ ની મોબાઇલ એપ્લિકેશન છે (IMD), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES), ભારત સરકાર સીમલેસ અને યુઝરફેન્ડલી હવામાનની માહિતી/પ્રોડક્ટ પ્રદાન કરે છે તે આપેલ સાઈટ પરથી જોઈ શકાય છે (<https://mausam.imd.gov.in>).

વપરाशक्तीઓ અવलોકન કરેલ હવામાન, આગાહી, રડાર છબીઓ એક્સેસ કરી શકે છે અને તોળાઈ રહેલા હવામાન ઘટનાઓ વિશે સક્રિયપણે ચેતવણી આપે છે.

એપ્લિકેશનના વિકાસ અને જમાવટનું નેતૃત્વ ભારત પૃથ્વી વિજ્ઞાનના મોનસૂન મિસન કાર્યક્રમહેઠળ સંયુક્ત રીતે ICRISAT ના ડિજિટલ એગ્રીકલ્યુર અને યૂથ ટીમ દ્વારા અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાખા સંસ્થા (IITM) દ્વારા કરવામાં આવે છે.

### દામિની એપ્લિકેશન


દામિનીએપ હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક મોબાઇલ એપ છે. જે વિજળી પડવાથી લોકોને સાવધાન કરવા માટે ભારત સરકારના પૃથ્વીવિજ્ઞાન મંત્રાલયના આધીન ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા પુણે એ 'દામિનીએપ' વિકસિત કરી છે.

### દામિની એપ કેવી રીતે કામ કરે?


દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજપાત જેવી સંભાવનાનો સચોટ જાણકારી આપે છે. એ માટે ઉષ્ણકટિબંધીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ દેશભરમાં અંદરું ૪૦ સેન્સર સાથે એક લાઈટનિગ લોકેશન નેટવર્ક પ્રસ્થાપિત કરેલ છે. આ નેટવર્કના આધારે જ દામિનો એપને વિકસિત કરવામાં આવેલ છે, જે ૪૦ કિમીના વિસ્તારમાં વિજળી પડવાની સંભવિત સ્થાનની જાણકારી આપે છે. રિપોટ્સ અનુસાર, આ નેટવર્ક વિજળી પડવાનો સચોટ પૂર્વાનુમાન જણાવે છે. વિજળીના કડાકા સાથે તે વજપાતનો સ્પીડ પણ બતાવે છે.

### વજપાતની સ્થિતિમાં લેવાના પગલાં...

આ એપમાં નીચે વધારે ઈન્ફોર્મેટિવ જાણકારી આપવામાં આવી છે. વીજળી પડવા પર બચાવ કેવી રીતે કરે, તેના વિશે જણાવવામાં આવ્યું છે. સુરક્ષાના ઉપાય સિવાય પ્રાથમિક ચિકિત્સા સંબંધી જાણકારી પણ આપવામાં આવી છે. વિજળી પડવાની ઘટના વ્યક્તિઓ અને પશુઓ માટે પણ ઘાતક હોય છે. તેને રોકી તો ના શકાય પરંતુ તેનાથી બચી તો શકાય છે.



વિજળી પડવાની સ્થિતિના વિશે જાગૃતાં ખૂબ જ જરૂરી છે. દામિની એપના માધ્યમથી તેનું પૂર્વાનુમાન લગાવી શકાય છે અને એવામાં લોકોની પાસે પર્યાપ્ત સમય પણ હોય છે કે તે સુરક્ષિત જગ્યા પર ચાલ્યા જાય. એટલે કે, સતર્ક થઈને જાનમાલના નુકસાનથી પણ બચી શકાય છે.



### દામિની એપ મોબાઇલમાં ડાઉનલોડ કરવાની રીત:-

દામિનો એપને મોબાઇલમાં ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે. એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર દ્વારા અને આઈફોન યુઝર્સ તેને એપ્પલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કર્યા બાદ તેમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તે માટે તમારે તમારું નામ, લોકેશન વગેરે એડ કરવાનું હોય છે. તે જાણકારીઓ આપવાની સાથે સાથે દામિની એપ સ્ટાર્ટ થઈ જશે. તમારા લોકેશનના ૪૦ કિમીના વિસ્તારમાં વિજળી પડવાની ચેતવણી ઓડિયો મેસેજ અને SMS ના આધારે આપે છે.

### દામિની એપ દ્વારા મળતી ચેતવણી બાદ લેવાના પગલાં:-

- જો તમને ચેતવણી મળી જાય તો સૌ પહેલાં તમે ખુલ્લા ખેતર, વૃક્ષોની નીચે, પહાડી વિસ્તારોની આસપાસ બિલકુલના રોકાવો.
- ધાતુના વાસણને ધોવાથી બચો અને નહાવાથી તો બિલકુલ બચો વરસાદથી પણ બચો અને ખાસ કરીને એવી જગ્યા કે જ્યાં જમીન પર પાણી જમા હોય ત્યાં પણ ઊભાના રહો.
- વીજળીના હાઈટેન્શન તાર અને ટાવરથી દૂર રહો.
- જો કઈ બહાર હોવ તો અને ઘરે જવાનું શક્ય ના હોય તો ખુલ્લી જગ્યા પણ કાન બંધ કરીને ઘૂટણીએ બેસી જાઓ અને ખતરો તળતા ઘરે ચાલ્યા જાઓ.